



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૮/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૫૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૫૫ લીટર દેશી દારૂ, ૩૦૩ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૩૬૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી, ૦૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૫૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૫૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓને અને પાસા હેઠળ ૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૫૩/૧૯

વસ્ત્રાપુર : જયવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૭)(રહે.હરીવીલા રો-હાઉસ, સીમા હોલની સામે, આનંદનગર રોડ, સેટેલાઈટ) એ તા.૧૦/૦૮/૨૦૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૧૦/૧૮ થી તા.૦૯/૦૫/૧૯ સુધીના સમયગાળા દરમિયાન ન્યુયોર્ક ટાવર પહેલા માળે આવેલ નોટરીની ઓફીસ ખાતે આરોપી (૧) પરાગભાઈ ગીરધરભાઈ ગણાત્રા (રહે.ઈન્દ્રપ્રસ્થ ટાવર હીમાલયા મોલની બાજુમા ડ્રાઇવઇન રોડ વસ્ત્રાપુર) તથા તેનો મિત્ર (૨)રમેશભાઈ દેસાઈ (રહે.મેમનગર) એ ભેગામળી પોતાના સ્વતંત્ર માલીકીની જમીન નહીં હોવા છતા પોતે સ્વતંત્ર માલીક હોવાનો ખોટો ભાડા કરાર કરી, પોતે માલીક હોવાનું દર્શાવી, જયવીરસિંહ પાસેથી જમીન ભાડે ની ડીપોઝીટ પેટે રૂપિયા ૩,૦૧,૦૦૦/- અને ભાડા પેટે કુલ રૂપિયા ૪,૮૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૬૧,૦૦૦/- મેળવી લઈ, તેમજ જગ્યાએ કરેલ “ડેનીસ કોફી બાર” ના બાંધકામ ખર્ચ પેટે રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- નું આર્થીક નુકશાન કરાવી જયવીરસિંહ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

કાલુપુર : અલ્કેશભાઈ ભાનુપ્રસાદ ઠાકર (ઉ.વ.૫૧)(રહે.ઈસ્કોન રેસીડન્સી પટેલ સોસાયટી ગુલબાઈ ટેકરા) એ તા.૧૦/૦૮/૨૦૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૪/૨૦૧૮ થી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન ગાંધીરોડ, કિષ્ના કોમ્પલેક્ષ, પહેલો માળ દુકાન નંબર-૪ ખાતે આવેલ “અંબિકા વિદ્યુત કાર્યાલય” નામની દુકાન ખાતે આરોપી (૧) રાજેશ એસ.શારદા અને (૨)ગૌરીશંકર શારદા (રહે. સેકન્ડ ફર્સ્ટ સ્ટેજ પેનીયા ઇન્ડ એસ્ટેટ બેંગલોર) એ ભેગામળી શારદા બ્રાંડના કેપેસીટરો નો ધંધો કરી, જેમા છ માઇક્રોન ફિલ્મના કેપેસીટરો આપવાનુ કહી, પાંચ માઇક્રોનના કેપેસીટરો નો માલ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- નો આપી, તેમજ સને-૨૦૧૩ થી માર્ચ/૨૦૧૯ દરમ્યાન આપેલ પાંચ માઇક્રોનના કેપેસીટરો પેટે કુલ રૂપિયા ૩,૦૦,૦૦,૦૦૦/- નું આર્થિક નુકશાન કરી, અલ્કેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જી.વસાવા ચલાવે છે.

સેટેલાઇટ : કલ્પેશભાઈ સુખરામભાઈ મહેશ્વરી (ઉ.વ.૨૮)(રહે.રત્નદિપ સોસાયટી ફલાભાઈ પાર્ક ની બાજુમાં બરોડા રોડ તા.હાલોલ જી.પંચમહાલ) એ તા.૧૦/૮/૧૯ ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૮/૨૦૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન સેટેલાઇટ ઈસ્કોન ચાર રસ્તા ખાતે આરોપી (૧) સ્મિતુલ છોટ્ટભાઈ પટેલ (રહે.કૃષ્ણનગર સોસાયટી હાલોલ) (૨) રાજેન્દ્રભાઈ અશોકભાઈ (રહે.ડાકોર વડવાળુ ફળીયાની ભાગોળમાં ડાકોર) (૩) સંજય પટેલ અને અને બે અજાણ્યા ઈસમો (જેના નામ- સરનામાની ખબર નથી તે) ભેગામળી કલ્પેશભાઈને તેમના મિત્ર રાજેશભાઈ શાહ તથા દિપકભાઈ સોનીને ૫૦૦ ગ્રામ સોનું બીલ સાથે કુલ રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- માં આપવાનો વિશ્વાસ આપી, ૫૦૦ ગ્રામ સોનું નહિ આપી, રોકડ રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- મેળવી લઇ, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.ગમારા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૫૪/૧૯

નિકોલ : (૧) અશોકભાઈ ઉકાભાઈ વાળદરીયા (ઉ.વ.૩૩)(રહે.સાર્થક એલીગંસ અમરજવાન સર્કલ પાસે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૯ ના કલાક ૬/૩૦ થી ૮/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનમાં સિલીંગ ફેન સાથે રસો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અશોકકુમાર ગલાભાઈ ચલાવે છે.

નિકોલ : (૨) અમિત હર્ષદભાઈ ભાવસાર (ઉ.વ.૩૮)(રહે.ઓતંબા સોસાયટી, વિધ્યાનિકેતન સ્કુલની સામે ખોડિયાર નગર નિકોલ) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૯ બપોરના ૨/૩૦ થી ૩/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનમાં બાથરૂમ આગળ લોખંડ ની સીડી સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રામસિંહ ચેહરસિંહ ચલાવે છે.

નારોલ : (૧) શોભાદેવી વા/ઓ વિક્રમસિંહ રાજપુત (રહે.વૈશાલીનગર, નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૯ ના કલાક ૫/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે છતની લોખંડની પાઈપ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ટી.કે.દેવમુરારી ચલાવે છે.

નારોલ : (૨) સતવીરસિંહ મુલારમ કુવાલ (ઉ.વ.૪૮)(રહે.સમૃધ્ધી રેસીડેન્સી આકૃતિ ટાઉનશીપ ની સામે નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૯ સાંજના ૬/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે સ્વામીનારાયણ કોમ્પલેક્ષ નજીક “નવીન રોડ કેરીયર” ઓફીસની બાજુમાં આવેલ બંધ મકાનમાં છત ના ભાગે પ્લાસ્ટીક ની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રીટાબેન સુરેશભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.